

PART PLAN OF DRAFT TOWN PLANNING SCHEME NO: 3 (GHUMA)

Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat


Notification NO:- GH/ V/ 24 of 2016/TPS- 112011- 3314- L, Dtd:- 04/02/2016.

ORIGINAL PLOT NO: -

FINAL PLOT NO: 226



SCALE: 1c.m.= 25 Mts.



This part plan is certified for the F.P NO: 226

Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

(2) Final plots boundary and allotment of final plot as subject to variation.

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડવાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. 25210922/5940 તા. 22/09/21 થી નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. 232/23 તા. 22/09/21 રૂ. 1000/- નવસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

Prep. By

Chd. By:

H. D' man:

LEGEND

- O.P BOUNDARY
- F.P BOUNDARY
- ROAD
- T.P.S BOUNDARY

TRUE COPY

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

PART PLAN SHOWING
BLOCK. NO.:- 798
MOJE:- GHUMA
TALUKA:- DASKROI
DISTRICT:- AHMEDABAD




1 c.m. = 40 mt.

LEGEND

- Residential Affordable Housing Zone 1 - RAH-1
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt.of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.



This part plan is certified for the BLOCK. NO. :- 798

NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.

(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2021...../.....
Amount Recieved Rs. ..1.050...../-
Receipt No.....7.33...../.....24..... Dtd.22.11...../2021.


TRUE COPY

Shah
22/09/2021
TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

Prep. By:

Chd. By:

H. D' man:



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- RZ/20210922/3785

અરજી તા.:- ૨૨/૦૯/૨૦૨૧

પરિણે નં.:-૭૩૩/૨૫, તા.:- ૨૨/૦૯/૨૦૨૧.

અરજદારશ્રી:- પાર્થ પટેલ,

ઘાટલોડીયા, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GH/V/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

મોજ/ રેવન્યુગામ :- ધુમા

બ્લોક નંબર :- ૭૯૮

રી.ડી.પી. શીટ નં. :- ૧૦૩

ની જમીન રેસિડેન્સિયલ એફોર્ડેબલ હાઉસિંગ ઝોન-૧(RAH-1)માં આવે છે.


નોંધ:

૧. સદરહુ જમીન ડ્રાફ્ટ મંજૂર ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.:- ૩ (ધુમા) ના વિસ્તારમાં આવતી હોવાથી તેને ટા.પ્લા. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો- જોગવાઈઓ ફેરફારને તથા ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રીના નિર્ણયને બંધનકર્તા રહેશે.

૨. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.


તારીખ ૨૨/૦૯/૨૦૨૧.

જ. ડ્રાફ્ટસમેન


૨૨/૦૯/૨૦૨૧
હેડ ડ્રાફ્ટસમેન

ખરી નકલ

૨૨/૦૯/૨૦૨૧
ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.